

DHWANI INDUSTRIAL PARK-5 (PHASE-2)

Village: Veraval, Taluka: Kotda Sangani, Dist: Rajkot.

REF NO.

તારીખ :-

એલોટમેન્ટ લેટર નં.....

પ્રોજેક્ટ- "ધ્વનિ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-૫", મુ. વેરાવળ, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ.

બુકીંગ કમ એલોટમેન્ટ લેટર

આથી અમો લખી બંધાઈએ છીએ કે શ્રી
એ અમારો પ્રોજેક્ટ કે જે ગુજરાત રાજ્યના રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ રાજકોટ, રાજકોટ જિલ્લાના કોટડા-સાંગાણી તાલુકાના મોજે ગામ વેરાવળ ગામના રીસર્વે થતા પ્રમોલગેશન મુજબના રેવન્યુ સર્વે નં. ૬૧૪/૨ ની બીન ખેડવાણ અને ઈમારત બાંધવાની મંજૂરી વાળી જમીન ચો.મી. ૮૩૨૮-૦૦ માંહેથી પ્રપોઝ ટીપી રોડ તથા રીઝર્વેશનમાં કપાત થતા બાકી રહેતી જમીન ચો.મી.આ. ૪૯૯૬-૮૦ ઉપર જનરલ ઔદ્યોગીક હેતુ માટે ઈમારત બાંધવાની મંજૂરીવાળા "ધ્વનિ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-૫" તરીકે ઓળખાય છે.

અમોએ સદર પ્રોજેક્ટ રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ-૨૦૧૬ અંતર્ગત સક્ષમ અધિકારી સમક્ષ ર સ્ટ્રેશન નંબર-PR/ GJ/ RAJKOT/ RAJKOT/ OTHERS/ _____/_____ થી રજીસ્ટર્ડ કરાવેલ છે.

સદર "ધ્વનિ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-૫" માંહેથી તરીકે ઓળખાય છે તેના પ્લોટ નંબર-.....ની જમીન ચો.મી.આ.....-..... તે સાથે કોમન એરીય સહિતનો, લાગુ પડતા કાયદા મજકુર "રેરા" કાયદાની કલમ-૨ ના ખંડ "એન" મુજબ સહિયારી સુવિધામાં વરાળે પડતા હકક સહિત તારીખ ---/---/૨૦--- ના રોજ ફાળવવામાં આવેલ છે. તે પેટે બુકીંગ એડવાન્સ અવેજની રકમ નાં રૂા. ---/- અંકે રૂપિયા --- પુરા --- બેંકની --- શાખાના ચેક નં --- તારીખ ---/---/૨૦--- ના રોજ તમો બુકીંગ/ટોકન પેટે ચુકવવામાં આવેલ છે. હાલના સમયે સદર મિલકતની વેચાણ કિંમત રૂા. ---/- અંકે રૂપિયા --- પુરા પ્રવર્તમાન બજાર કિંમત નક્કી કરવામાં આવેલ છે. તે આપણે બન્ને પક્ષકારને કબુલ તથા મંજૂર છે. સદર મિલકતની ચતુર્દિશા નીચે મુજબ છે.

ઉતરે : ----- આવેલ છે.

દક્ષિણે : ----- આવેલ છે.

પુર્વે : ----- આવેલ છે.

પશ્ચિમે : ----- આવેલ છે.

આથી તમોને સદર મિલકત એલોટ કરવામાં આવેલ છે તથા નીચે જણાવેલ શરતો અને સમજૂતી ઓનેઆધિન રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરી આપવાનો છે. તે બદલ ખરીદનાર તથા વેચાણ આપનારની નીચે સહી કરી શાખ આપેલ છે.

—:: શરતો અને સમજૂતીઓ ::—

1. પ્રોજેક્ટના રેરા રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ તથા પ્રોજેક્ટની જમીનને લગતા ટાઈટલ દસ્તાવેજો, બાંધકામ પ્લાન, ડીઝાઈન અને નિર્દેષ્ટ હકીકતો (**Specifications**) તદુપરાંત જે જમીન ઉપર પ્રોજેક્ટનું બાંધકામ કરેલ છે/ કરવામાં આવશે તેના માલીકી બાબતે હકક, ઈલાખા (ટાઈટલ)ની સ્થિતિ દર્શાવતા મહેસુલી દફતર (ગામ નમુના વિગેરે)ના ઉતારા અથવા સીટી સર્વે દફતરની અધિકૃત નકલો લે—આઉટ પ્લાન/ પ્રોજેક્ટ બાંધકામની અધિકૃત નકલો એલોટી દ્વારા તપાસવામાં આવેલ છે તથા એલોટીને તે બાબતે સંપૂર્ણ સંતોષ કરેલ છે.
2. ઉપર દર્શાવેલ કુલ વેચાણ કિંમતમાં ટેક્ષ, સેઝ અથવા અન્ય તેવા સરખા ટેક્ષો કે જે લાગુ પાડવામાં આવે અને જે બાંધકામ સાથે જોડાયેલા હોય તેનો સમાવેશ થતો નથી. અવેજની ચુકવણી કરતા સમયે જે તે રકમ ઉપરાંત પ્રવર્તમાન દર મુજબ જી.એસ.ટી. તથા અન્ય ટેક્ષ, વેરા, ચાર્જ જે વખતો વખત સરકારશ્રી દ્વારા લાગુ પાડવામાં આવે તે તમો ખરીદનારે અલગથી ચુકવવાની રહેશે.
3. પ્રમોટર સમગ્ર પ્રોજેક્ટનું બાંધકામ તારીખ ૩૦/૯/૨૦૧૯ સુધીમાં પુર્ણ કરશે અથવા તે પહેલા સોંપી આપશે.
4. એલોટીએ એલોટમેન્ટ લેટર ઈસ્યુ થયેથી દિવસ—૩૦ માં કુલ અવેજના ૧૦% રકમ ચુકવી આપવાની રહેશે અને કબજા રહિત વેચાણ કરાર માટેના જરૂરી દસ્તાવેજો પુરા પાડવાના રહેશે અને રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, ૨૦૧૬ ની જોગવાઈઓ અને નિયમોનુસાર કબજા રહિત વેચાણ કરાર રજીસ્ટર્ડ કરવામાં આવશે અને તે બંને પક્ષકારોને બંધનકર્તા રહેશે.
5. કબજા રહિત વેચાણ કરાર તથા કન્વેયન્સ ડીડ(વેચાણ દસ્તાવેજ)ની સ્ટેમ્પડયુટી તથા નોંધણીનો ખર્ચ એલોટી કરશે તથા તે રકમ તેણે ચુકવવાની રહેશે.
6. એલોટી દ્વારા એલોટમેન્ટ લેટર ઈસ્યુ કર્યા બાદ દિવસ—૩૦ માં કુલ અવેજના ૧૦% રકમ ચુકવવામાં નિષ્ફળ રહેશે તો એલોટમેન્ટ લેટર આપોઆપ રદબાદલ થશે તથા બુકીંગ/ટોકન તરીકે ચુકવેલ રકમ વગર વ્યાજે પરત કરવામાં આવશે.

તારીખ :- / /૨૦૧

સ્થળ. રાજકોટ

.....
"ધ્વનિ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-૫" પ્રોજેક્ટના પ્રમોટર
શ્રી ઘનશ્યામભાઈ વાલજીભાઈ કોરાટ વિગેરે

.....
તે વેચાણ રાખનાર

શાખ:-

શાખ:-